

ROBERT RESOURCES LIMITED

CIN: - L99999GJ1982PLC096012

REGD. OFF: - 3rd FLOOR, PLOT NO 1067, OPP. BINDU NIVAS, KALIYABID ROAD
BHAVNAGAR-364001, GUJARAT, Contact No: +91- 6358905872

Email: - robertresourceslimited@gmail.com Website: - www.robertresources.com

Date: 4th September, 2023

To, MSEI Ltd. Vibgyor Towers, 4 th Floor, Plot No. C 62, G- Block, Opp. Trident Hotel, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 098	To, THE CALCUTTA STOCK EXCHANGE LIMITED 7, Lyons Range, Dalhousie, Kolkata-700001, West Bengal
---	--

Ref: Scrip Code: 10028181

Sub: Newspaper Publication - Notice of 41st AGM

Dear Sir/Ma'am,

we are enclosing herewith copies of Newspaper Advertisement regarding Notice in respect of the 41st Annual General Meeting to be held on Saturday, 30th September, 2023 at 5:00 P.M. published in English daily "WESTERN TIMES, AHMEDABAD" and in Gujarati (Local) daily "WESTERN TIMES, AHMEDABAD" both newspapers dated 4th September, 2023.

Kindly take the information on your records.

Thanking you,

Yours Faithfully,

For, Robert Resources Limited

AMI NAYNESH
KOTHARI

Digitally signed by AMI NAYNESH KOTHARI
DN: cn=AMI NAYNESH KOTHARI, o=ROBERT RESOURCES LIMITED, ou=ROBERT RESOURCES LIMITED, email=ami.naynesh.kothari@robertresources.com, c=IN
Date: 2023.09.04 12:00:51 +05'30'

Ami kothari
Company Secretary & Compliance Officer
ACS 30306

60% Indians believe growing e-gaming sector can stem brain drain: Study

New Delhi, (IANS) About 60 per cent of Indians believed that the homegrown online skill gaming sector can give people a chance to create for the world and could stem the brain drain to overseas tech jobs, according to a study on Monday.

This comes as during the academic year 2021-22, over 200,000 Indian students pursued higher education in the US, while the Indian IT sector faced a persistent 25.2 per cent attrition rate in 2021. The continuing trend of talent exodus forecasts the potential departure of 2 to 2.2 million IT-BPM professionals by 2025.

Amidst this scenario of talent drain, the online gaming sector emerges as a promising career avenue, fostering skill growth and

innovation within India's tech landscape, revealed the study by the E-Gaming Federation (EGF) and Indian Statistical Institute, Kolkata (ISI). "The research highlights the symbiotic relationship between technology and gaming. As the industry rapidly evolves, we have a unique opportunity to harness the creative potential of our youth and build a robust ecosystem that nurtures both technological innovation and economic growth," said Dr. Diganta Mukherjee, Professor at the ISI, in a statement. "This analysis unearths a strong belief among the respondents that India's homegrown gaming industry can reduce the brain drainage of talents in the technology domain, offering them opportunities towards inno-



novation and growth right here on home soil," added Dr. Subhamoy Maitra, Professor from the Institute. Conducted through an extensive survey of 4,644 individuals across Andhra Pradesh, Telangana, Kerala, Karnataka, and Tamil Nadu, the study demonstrates a very strong interest among both students and professionals in the online skill

gaming sector. The findings showed that 73 per cent of Indians have a strong inclination towards pursuing a career in the online skill gaming sector, highlighting the sector's vast growth potential. Further, 68 per cent people acknowledged the role of gaming in enhancing skill

sets. The study also showcased the online skill gaming sector's appeal to highly skilled engineers, with 55 per cent of respondents identifying it as a preferred domain due to its emphasis on technology adaptation and innovation. This sentiment aligns with the industry's rapid integration of advanced technologies like AI/ML and VR, positioning India as a leading force in technological advancements. Around 67 per cent participants showed a willingness to pursue professional education in the gaming sector, indicating a desire to up-skill and contribute to the industry's growth. The participants also recognised the potential of 'gamification' in ex-

panding the scope of the gaming industry, with 56 per cent agreeing that it offers tremendous oppor-

tunities for innovation. Over 62 per cent individuals perceived that the opportunities in the online

skill gaming sector can enhance the overall skill sets of students and employees alike.

Now securely access sensitive images stored in Google Photos from more devices

San Francisco, (IANS) Google has rolled out a new update across its Photos app that will make it easier to secure and access your sensitive images across all of your devices. The company is rolling out the 'Locked Folder' feature — which allows Android users to hide specific photos and videos behind a passcode — to iOS and web users, as well as a new option to back up Locked Folders in order to access those encrypted



images across multiple devices using Google's cloud. "Today, we're starting to roll out the option to back up your Locked Folder so you can access those photos and videos with your passcode on any of your devices. Plus, you'll now be able to set up and access Locked Folder on iOS devices and the web," Google said in a blogpost on Tuesday. According to the company, photos and videos saved and backed up in your

Locked Folder will not appear anywhere else in the app — you won't see them in your photos grid, Memories, albums, or when you search for photos in Google Photos until you enable backup for Locked Folder. "When you turn on backup for Locked Folder, you'll be able to access that content across your devices when you sign in to Google Photos and open Locked Folder with your device's passcode," Google said.

Coworking firm BHIVE to set up Rs 400 cr fund

Bengaluru-based coworking firm BHIVE group is setting up a Rs 400 crore alternate investment fund (AIF) to acquire commercial real estate. BHIVE said the company has launched its new co-working-focused Rs 400 crore CAT-2 AIF. The fund will acquire commercial real estate properties at prime locations with clear titles and occupancy certificates, it added.

The new fund will offer an opportunity to High Networth Individuals (HNIs) and family-owned businesses looking to participate in the commercial real estate growth story with a minimum investment of Rs 1 crore.

GQG raises stake in Adani Ports to over 5%; investment now in Adani firms Rs 38,700 cr

US-based boutique investment firm GQG Partners has raised its stake in Adani Ports & Special Economic Zone (APSEZ) to over 5 per cent as it continues to bet on billionaire Gautam Adani's group struggling off market concerns. The Fort Lauderdale, Florida-based GQG increased its stake in APSEZ from 4.93 per cent to 5.03 per cent by way of bulk deal, stock exchange filings showed. GQG now has a stake in five of the 10 Adani Group firms. It on August 16 bought 7.73 per cent stake in Adani Power Ltd. Promoter group firms Worldwide Emerging Market Holding and Afro ASIA Trade And Investments sold 8.09 per cent stake in Adani Power through block deals. GQG bought 7.73 per cent, filings showed. After the stake sale, promoter holding in Adani Power declined to 66.88 per cent from 74.97 per cent. The investment comes days after Deloitte quit as auditor of APSEZ, renewing investor concerns even as the group slowly recovers from the effects of a report by US short-seller Hindenburg Research. The Hindenburg report released January 24 alleged accounting fraud, stock price manipulation and improper use of tax havens, triggering a stock market rout that had erased about USD 150 billion in the market value at its lowest point.

FBI dismantles Qakbot malware that infected thousands of computers globally

San Francisco, (IANS) The Federal Bureau of Investigation (FBI) has disrupted and dismantled the infamous Qakbot malware, and has identified more than 700,000 infected computers worldwide, including more than 200,000 in the US.

The Department of Justice (DoJ) announced a multinational operation involving actions in the US, France, Germany, the Netherlands, the UK, Romania, and Latvia to disrupt the botnet and malware known as Qakbot and take down its infrastructure.

The Qakbot malicious code is being deleted from victim computers, preventing it from doing any more harm. The DoJ also announced the seizure of more than \$8.6 million in cryptocurrency in illicit profits.

The action represents the largest finan-

cial and technical disruption of a botnet infrastructure leveraged by cybercriminals to commit ransomware, financial fraud, and other cyber-enabled criminal activity.

Cybercriminals who rely on malware like Qakbot to steal private data from innocent victims have been reminded that they do not operate outside the bounds of the law, said Attorney General Merrick B. Garland.

Together with our international partners, the Justice Department has hacked Qakbots infrastructure, launched an aggressive campaign to uninstall the malware from victim computers in the United States and around the world, and seized \$8.6 million in extorted funds, he said in a statement late on Tuesday.

This operation also led to the seizure of almost \$9 million in cryptocurrency from the Qakbot cybercriminal organisation, which will now be made

available to victims.

The Operation "Duck Hunt Team utilised their expertise in science and technology, but also relied on their ingenuity and passion to identify and cripple Qakbot, a highly structured and multi-layered bot network that was literally feeding the global cybercrime supply chain, said Donald Director, the Assistant Director in Charge of the FBI's Los Angeles Field Office. According to court documents, Qakbot is controlled by a cybercriminal organisation and used to target critical industries worldwide. The Qakbot malware primarily infects victim computers through spam email messages containing malicious attachments or hyperlinks. These ransomware groups caused significant harm to businesses, healthcare providers, and government agencies all over the world.

Hotel industry's contribution to India's GDP to hit \$1 trn by 2047: HAI

New Delhi: According to the report, the estimated growth can be attributed to factors such as GDP growth and increase in income level, increase in inflow of domestic tourists and foreign tourist arrivals (FTA). The direct contribution of Indian hotel industry to the country's GDP is estimated to touch \$ 1 trillion by 2047 driven by a significant jump in domestic tourist visits and international arrivals, according to a report. As per 'Vision 2047: Indian Hotel Industry' report by the Hotel Association of India (HAI) and Benori Knowledge, the direct contribution of the hotel in-

dustry to GDP was \$ 40 billion in 2022 and is expected to reach \$ 68 billion by 2027. The hospitality industry body also pointed out that for the sector to achieve its target, the accommoda-

tion can be attributed to factors such as GDP growth and increase in income level, increase in inflow of domestic tourists and foreign tourist arrivals (FTA). In the mid-term (2027-2037), domestic tourist visits are expected to increase from 677 million in 2021 to 1.5 billion by 2030 and are further expected to jump to 15 billion by 2047 in the long term (2037-2047), it added.



tion growth will have to go beyond the metros to two and three-tier cities and also to the rural areas. The total contribution includes aspects of services from corresponding industry verticals such as food and beverage, salon & spas but excludes consideration of services market growth and thus taking out scenario-based contribution estimates. According to the report, the estimated growth

can be attributed to factors such as GDP growth and increase in income level, increase in inflow of domestic tourists and foreign tourist arrivals (FTA). In the mid-term (2027-2037), domestic tourist visits are expected to increase from 677 million in 2021 to 1.5 billion by 2030 and are further expected to jump to 15 billion by 2047 in the long term (2037-2047), it added.

can be attributed to factors such as GDP growth and increase in income level, increase in inflow of domestic tourists and foreign tourist arrivals (FTA). In the mid-term (2027-2037), domestic tourist visits are expected to increase from 677 million in 2021 to 1.5 billion by 2030 and are further expected to jump to 15 billion by 2047 in the long term (2037-2047), it added.

Jio Financial Services lists on BSE with marginal gain

New Delhi: Shares of Jio Financial Services, the demerged financial services unit of Reliance Industries, listed on the bourses on Monday, with the shares rising marginally on BSE. The trade at Rs 265, up 1.20 per cent, against Rs 261.85, the price fixed at a

special price discovery session held last month. It later jumped 6.24 per cent to Rs 278.20. Shares of the company listed at Rs 262 on the NSE and further climbed to Rs 262.05. The company commanded a market valuation of Rs 1,59,943.93 crore in morn-

ing deals. Jio Financial Services Ltd. (JFSL) demerged from Reliance last month. In a special price discovery session held on the record date last month, the stock's pre-listing price came out to be Rs 261.85 per share. Trading members of the exchange are hereby informed that the equity shares of Jio Financial Services Ltd.

Indian economy shining as beacon of hope in challenging times: Modi

New Delhi: Prime Minister Narendra Modi asserted that India's economy is shining as a beacon of hope in these challenging times. With robust growth and resilient spirit, the future looks promising. Let us keep this momentum and ensure prosperity for 140 crore Indians, he said on X, reacting to news portal Moneycontrol's 'Bullish on India' campaign. The portal, which specialises in reporting

on markets and financial sector, had posted on X that the country's economy has not just withstood challenges, but thrived setting the stage for optimism. The 'Bullish on India' campaign showcases India's economic resilience and growth potential in various critical sectors, it said.

It aims to analyse the key drivers of India's economic growth while fostering awareness about the unparalleled poten-

tial the nation offers at a time of a global economic slowdown, the portal said in a separate statement.

With detailed analysis of macroeconomic factors such as manufacturing, demography, economy, markets and India's rising stand in the global leadership, 'Bullish on India' has been presented as a data backed campaign that underlines India's resilient economic growth, it said.

WESTERN RAILWAY - VADODARA DIVISION
ENGINEERING DEPARTMENT
E-TENDER NOTICE NO. DRM-BRC 083 of 2023-24: Sealed Tenders for and on behalf of The President of India are invited by Divisional Railway Manager (WA/C), Western Railway, Pratapnagar, Vadodara - 390 004 for the following works:- **Sr. No. (1) Tender No. & Name of Work: DRM BRC 083 of 2023-24. Vishwamitri-Dabhoi Section:-** Elimination of existing level crossings by provision of Road under Bridge (RUB) on LC No. 10, 13, 16, 17, 24, 30 & 33. **Approximate cost of the work:** ₹ 43,67,48,399.43/- **Bid Security to be deposited:** ₹ 23,33,800.00/- **Date and time for submission of tender and opening of tender:** Tender is to be submitted on 25.09.2023 before 15.00 Hrs. and is to be opened on same date at 15.30 Hrs. **Website particulars and notice for location where complete details can be seen & Address of the office from where the tender form can be purchased:** Website @ www.ireps.gov.in Divisional Railway Manager (WA/C) Western Railway, Pratapnagar, Vadodara-390004. **W/E23/NIT of 2023-24 dated 01.09.2023 - 166**
 Like us on: www.facebook.com/WesternRly

Form No. INC-26
 [Pursuant to rule 30 of the Companies (Incorporation) Rules, 2014] Advertisement to be published in the newspaper for change of registered office of the company from one state to another Before the Regional Director Northern Region, New Delhi
 In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014
 AND
 In the matter of **Coral Laboratories Limited** having its registered office at SF-206, Silver Oak Complex, B.P.C Road, Vadodara-390020, Gujarat
 Applicant
 Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Annual General Meeting/Extra ordinary general meeting held on Friday, August 11, 2023 to enable the company to change its Registered Office from "The State of Gujarat" to "The State of Maharashtra, within the jurisdiction of the Registrar of Companies, Mumbai".
 Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver either on the **MCA-21 portal (www.mca.gov.in)** by filing investor complaint form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director, Northern Western Region, ROC Bhavan, Opp Rupal Park Society, Behind Ankur Bus Stop, Naranpura, Ahmedabad-380013, Gujarat within fourteen days of the date of publication of this notice with a copy to the applicant company with a copy of the applicant company at its registered office at the address mentioned below:
 Registered Office:
 Coral Laboratories Limited
 SF-206, Silver Oak Complex,
 B.P.C Road, Vadodara-390020, Gujarat
 Email: cs@corallab.com
For & on behalf of
Coral Laboratories Limited
Sushma Kadkade
(DIN: 07791735)
(Director & CFO)
September 2, 2023
Vadodara

Tender
Gujarat Livelihood Promotion Company Limited
Tender for Appointment of Social Media/Digital Marketing Agency
 Bidders are invited by Gujarat Livelihood Promotion Company for appointment of social media/digital marketing agency. The tender details can be found on www.glpcc.co.in and www.gem.gov.in.
 Last date of submission of tender document is 29/09/2023 3:00 pm. Sealed tenders to be submitted to Gujarat Livelihood Promotion Company, 3rd floor, Block No.18, Udyog Bhavan, Sector-11, Gandhinagar-382011
 Bidders are advised to regularly visit the website for the further updates until the completion of tendering process.
 Place: Gandhinagar
 Date: 5/9/2023
INF/1198/23-24 **Managing Director**

ROBERT RESOURCES LIMITED
CIN: - L99999GJ1982PLC096012
 REGD. OFF :- 3rd FLOOR, PLOT NO 1067, OPP. BINDU NIVAS, KALIYABID ROAD, BHAVNAGAR-364001, GUJARAT, Contact No: +91-6358905872
 Email: robertresourceslimited@gmail.com Website: www.robertresources.com
NOTICE OF 41ST ANNUAL GENERAL MEETING
 Notice is hereby given that the 41st Annual General Meeting (AGM) of the Company will be held on Saturday, 30th September, 2023 at the Registered Office of the Company to transact the business as mentioned in the AGM Notice.
 In compliance with the relevant circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2022-23 will be sent to all the share holders whose email addresses are registered with the Company/Depository Participant(s).
 • Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants.
 • Shareholders holding shares in physical mode are requested to get their shares in demat mode / furnish their email addresses and mobile numbers with the Company on robertresourceslimited@gmail.com and its Registrar and Share Transfer Agent i.e. skyline Financial Services Private Limited at info@skylineria.com.
 The notice of the 41st AGM and Annual Report 2022-23 will also be made available on the Company's website at www.robertresources.com and the Stock Exchanges websites at www.mseil.in and www.cse-india.com.
 Shareholders will have an opportunity to cast their vote through remote e-voting system or during the AGM on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of voting for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders.
 Members who have not registered their E mail address are requested to get the same registered, the Company will send the Notice of the 41st AGM and Annual Report for the year 2022-23 by way of an E mail only to those shareholders whose E mail ID are registered with Company / Depository Participants.
 Place : Bhavnagar **For, Robert Resources Limited**
 Date : 2nd September, 2023 **Ami Kothari**
 Company Secretary & Compliance officer

Tender
Gujarat Livelihood Promotion Company Limited
Tender for Appointment of Public Relation and Media Agency
 Bidders are invited by Gujarat Livelihood Promotion Company for appointment of Public Relation and Media agency. The tender details can be found on www.glpcc.co.in and www.gem.gov.in.
 Last date of submission of tender document is 29/09/2023 3:00 pm. Sealed tenders to be submitted to Gujarat Livelihood Promotion Company, 3rd floor, Block No.18, Udyog Bhavan, Sector-11, Gandhinagar-382011 Bidders are advised to regularly visit the website for the further updates until the completion of tendering process.
 Place: Gandhinagar
 Date: 5/9/2023
INF/11205/23-24 **Managing Director**

GALAXY BEARINGS LIMITED
CIN: L29120GJ1990PLC014385
 Regd. Office : A-53/54 Pariseema Complex, C. G. Road, Ellisbridge, Ahmedabad - 380006.
 Tel.: 079-29606020. Email: investor.gbl@gmail.com Website: www.galaxybearings.com
NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING OF THE COMPANY, E-VOTING AND BOOK CLOSURE
 Notice is hereby given that the 33rd Annual General Meeting (AGM) of the Company will be held on Tuesday, September 26, 2023 at 03:30 p.m. (IST) through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") (hereinafter referred to as "electronic mode") to transact the business as set out in the Notice convening the said Meeting and the Explanatory Statement thereto, in compliance with the provisions of the Companies Act, 2013 & Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the General Circular Nos. 14/2020 dated 08.04.2020, 17/2020 dated 13.04.2020, 20/2020 dated 05.05.2020, 02/2021 dated 13.01.2021, 19/2021 dated 08.12.2021, 21/2021 dated 14.12.2021, 02/2022 dated 05.05.2022 and 10/2022 dated December 28, 2022 (collectively referred to as "MCA Circulars") and Circular dated 12.05.2020, 15.01.2021, 13.05.2022 and 05.01.2023, issued by the Securities and Exchange Board of India. Members will be able to attend and participate in the ensuing AGM through audio visual means and the facility of appointment of proxy will not be available. Members attending the AGM through audio visual means will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.
 In Compliance with the relevant circulars, the Notice of the AGM and Annual Report for Financial year 2022-2023 have been sent to all the members whose email address are registered with Company/Depository Participant(s) and/ or Link Intime private Limited ("RTA") on August 25, 2023. The requirement of sending physical copies has been dispensed with pursuant to the aforesaid circulars. The Notice along with Annual Report is also available on the Company's website www.galaxybearings.com and website of BSE Limited at www.bseindia.com, respectively and on the website of the company's Registrar and Transfer Agent, Link Intime India Pvt. Ltd. at <https://instavote.linkintime.co.in/>
 Pursuant to the section 91 of the companies Act 2013 read with rules made thereunder and Regulation 42 of Listing regulations, the register of members and the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Wednesday, September 20, 2023 to Tuesday September 26, 2023 (both Inclusive Day).
 In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company has provided the facility to exercise their vote by electronic means (remote e-voting) as well as e-voting at AGM on all the resolutions set forth in notice of the 33rd AGM. The Company has engaged the service of Link Intime India Pvt. Ltd. ("LIIP") to provide e-voting facility. Further, it is informed that:
 The remote e-voting period will commence on September 23, 2023 at 09:00 a.m. (IST) and ends on September 25, 2023 at 05:00 p.m. (IST), thereafter remote e-voting module shall be disabled by LIIP for voting.
 The voting rights of members shall be in proportion to the Equity Shares held by them in the paid-up Equity Share capital of the Company as on September 19, 2023 ("Cut-off Date"). Any person, who is Member of the Company as on cut-off date is eligible to cast vote on all resolutions set forth in the notice of the AGM using remote e-voting or e-voting at AGM.
 Any person, who acquires Shares of the Company and become member after dispatch of notice and holding shares as on cut-off date i.e. September 19, 2023, may obtain Login ID and password by following instruction as mentioned in the Notice of the AGM or sending request to enotices@linkintime.com.
 Members who are present at the AGM through VC/OAVM and have not casted their vote on the resolutions through remote e-voting shall be eligible to vote through e-voting during the AGM. Detailed procedure and instructions for e-voting during AGM are mentioned in the Notice of the 33rd AGM.
 In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depositories/Registrar and Share Transfer Agent (RTA) so far, are requested to register/update their e-mail addresses in the following manner:
 a. Members holding shares in Demat mode can get their Email ID registered by contacting their respective Depository Participant.
 b. Members holding shares in Physical form can send request to the Company at investor.gbl@gmail.com or to RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in by providing necessary details like Folio No., Name of Shareholder, scanned copy of the Share Certificate (front and back), PAN and AADHAR (self-attested scanned copy), Contact No. for registering email address.
 In case of any queries or issues regarding e-voting, the Members may refer to 'Frequently Asked Questions' (FAQs) and e-voting manual available at <https://instavote.linkintime.co.in> under the help section or Members may contact at toll free number 022-49186000.
For GALAXY BEARINGS LIMITED
 Sd/-
Bharatkumar K Ghodasara
 Whole Time Director (DIN - 00032054)
 Place : Ahmedabad
 Date : September 04, 2022

Disclaimer
 Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERN TIMES" does not stand responsible for the sales proposition.

